



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૦૫/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૮૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૫ વ્યક્તિઓને ઝડપી, ૩૦૩ લીટર દેશી દારૂ, ૨૪૩ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૬૪ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૨૬ બિયર ટીન, ૧ કાર, ૧ રિક્ષા, ૧ મોટર સાયકલ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૯,૪૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૮૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૮૮૩/૧૯

નિકોલ: યોગેશભાઈ મનસુખભાઈ પટેલ (રહે.પતંજલી સોસાયટી ગાયત્રી સ્કુલ પાસે રતનપાર્ક સોસાયટીની બાજુમાં ઉત્તમનગર નિકોલ) એ તા.૨૧/૦૫/૧૯ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૨૦/૫/૧૯ કલાક ૧૧/૪૫ થી કલાક ૫/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૨૮,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૪૮,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.જે.ખાંટ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૮૮૪/૧૯

એરપોર્ટ: આશિષકુમાર ચંદુલાલજી બાગરેયા (રહે.શાંતિનગર કોલોની એચ.ડી.એફ.સી.બેન્કની બાજુમાં બાલોતરા જીલ્લો-બાડમેર રાજસ્થાન) એ તા.૨૧/૦૫/૧૯ નારોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૨૦/૫/૧૯ કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પોતાની લગેઝ બેગ ચેકીંગ બાદ બેગની ચેઈન ખુલ્લી જોતા બેગમાંથી રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- અજાણી વ્યક્તિએ ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.બી.પ્રજાપતિ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૮૮૫/૧૯

વાસણા: નિરાબહેન હર્ષદભાઈ શાહ (ઉ.વ.૫૫) (રહે. આયોજનનગર સોસાયટી જીવરાજ મહેતા હોસ્પિટલ સામે વાસણા) તા.૧૯/૦૫/૧૯ કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તા થી ધરણીધર બ્રીજ તરફ જતા પ્રાપ્તી ફ્લેટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ નિરાબહેન શાહના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ નિરાબહેન શાહે તા.૨૧/૫/૧૯ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ વુ.પો.સ.ઈ.શ્રી એસ.બી.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૮૬/૧૯

જીઆઈડીસી વટવા: નરેશભાઈ કાંતીભાઈ ઠાકોર (ઉ.વ.૩૭) (રહે. જયશ્રી સોસાયટી વિભાગ-૨ જસોદાનગર) એ અગમ્ય કારણસર તા.૨૧/૫/૧૯ નારોજ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી યુ.કે.જાદવ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.